### SUPERTEX INDUSTRIES LIMITED

#### An ISO 9001:2015 Certified Company

HEAD OFFICE: BALKRISHNA KRUPA, 2ND FLOOR, 45/49, BABU GENU ROAD, PRINCESS STREET,

MUMBAI - 400 002

TEL.: 91-22-22095630 / 31, 22069034

EMAIL: info@supertex.in • WEBSITE: www.supertex.in

CIN.: L99999DN1986PLC000046



Date:14th November, 2024

To,
Bombay Stock Exchange Limited
Department of Corporate Service,
P.J. Towers,
Dalal Street, Fort,
Mumbai – 400 001.

Scrip Code: 526133

### **Ref: Supertex Industries Limited**

Sub: Submission of Newspaper Advertisements of Unaudited Financial
Results of the Company for the quarter and half year ended 30<sup>th</sup> September,
2024

Dear Sir/Madam

Pursuant to the provisions of Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015, Kindly find attached herewith copies of newspaper advertisements of the Unaudited Financial Results of the Company for the quarter and half year ended 30<sup>th</sup> September, 2024, published in "Financial Express"- English Edition and "Lokmitra"-Gujarati Edition on Thursday, 14<sup>th</sup> November, 2024.

Kindly take the same on your records.

Thanking you

Yours faithfully

### For Supertex Industries Limited

SANJAY KUMAR MISHRA Digitally signed by SANLAY KLIMAR MISHRA
DN: C-IN, or-Personal title-1919,
pseudonym-1354428/2066062186E606/89227
E9699,
22.4 Ale-03816965999ea/28aa9220205669394b
2238412462072c21-6358579c4Gf132b,
poptalCode-900050; st-Maharashty-seribl/Numberied/279b733825/26456424ac4c3
2020209985911569951a1 air 28f88ac272c2d47,
cn=SANLAY KUMAR MISHRA
DAIL 2021-11.14123:313-45 307

Sanjay Kumar Mishra Director and CFO

DIN: 00304796 Encl : As above

REGD. OFFICE, UNIT | & II : PLOT NO. 45/46, PHASE II, PIPERIA INDUSTRIAL ESTATE, SILVASSA - 396230 (D & NH). TEL.: 07069127038 UNIT-III : 213, KHARVEL, BEHIND KHARVEL SUB-STATION, TALUKA-DHARAMPUR - 396050 DIST. VALSAD. GUJARAT. TEL.: 09374488624 SURAT : 605, TAKSHILA APARTMENT, 6TH FLOOR, MAJURA GATE, RING ROAD, SURAT - 395003. GUJARAT. TELEFAX : (0261) 3015060

# FINANCIAL EXPRESS

BEFORE THE NATIONAL COMPANY LAW TRIBUNAL BENCH- IV AT MUMBAI INTERLOCUTORY APPLICATION NO. 1515 OF 2024 COMPANY PETITION (IB) NO. 1029/IMB)/2022

(Now under Liquidation vide Order dated 29.04.2024 in IA No. 25/ 2024) Amit Vijay Karia ..Applicant Ritesh Shah and Ors. ...Respondents

In the matter between ...Financial Creditor Piramal Capital & Housing Finance Limited Rite Developers Private Limited ... Corporate Debtor NOTICE

Chandrashekar Balaji Parte Pratik Shantilal Jiyani Respondent No. 2 Respondent No 3 Suspended Director of Corporate Debtor Suspended Director of Corporate Debtor having his address at naving his address at having 3rd Floor, Krishna Bhuvan. his address at 3rd Floor, Krishna Bhuvan 67, Plot No. 67, Nehru Road, Vile Nehru Road, Ville Parle East, Mumbai-400057. Parle East, Mumbai 400 057 ritesh@rite.in ritevashodanandrealtors@gmail.com

Take notice that Interlocutory Application No. 1515 of 2024 under Section 60(5) of the Insolvency and Bankruptcy Code, 2016 is presented by the Applicant abovenamed before the Hon'ble National Company Law Tribunal, Court No. IV, Mumbai Bench. The last hearing in Interlocutory Application No. 1515 of 2024 was held on November 12, 2024. You are directed to appear in person/ through counsel before the Hon'ble Bench on the next date of

hearing, failing which the matter would be decided ex parte against you. TAKE NOTICE THAT the next date of hearing in Interlocutory Application No. 1515 of 2024 is January 8

> Mr. Nilesh Rajendra Kothan Liquidator of M/s Rite Developers Private Limited Registration No. IBBI/IPA-002/IP-N01225/2022-2023/14132 AFA valid upto: 31.12.2025

# केनरा बैंक Canara Bank

सिंदिकेट Syndicate Recovery Section, Navi Mumbai Regional Office: Circle Office Building, 8th Floor, 'A' Wing, C-14, G

Block, BKC, Bandra East, Mumbai- 400 051. **Email:** recoveryronm@canarabank.com Ref No SARFAFSI/CB/SS/2023 Dated: 31/10/2024 Regd. Post with Ack. Due

To the Borrower/Guarantors/Mortgagor:

1. M/S Cameravalas (Proprietor Mr. Ananda Birendra Chakravarti) C/10, Sujata Apartments, Off CST Road, Opp Mumbai University, Kalina, Santacruz (East), Mumbai Maharashtra - 400098 2. Mr. Ananda Birendra Chakravarti, C/10, Sujata Apartments, Off CST Road, Opp Mumbai University, Kalina, Santacruz (East), Mumbai, Maharashtra - 400098

3. MRS. Ritu Wadhwa, C/10, Sujata Apartments, Off CST Road, Opp Mumbai University, Kalina, Santacruz (East), Mumbai, Maharashtra - 400098 SUBJECT: Notice for exercising the right of redemption under Section 13 (8) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (hereinafter

The undersigned being the Authorized Officer of Canara Bank, Regional Office, Navi Mumbai, Maharashtra (hereinafter referred to as "the secured creditor"), appointed under the Act do hereby issue this notice, under Section 13(8) of the Act read with Rule 8(6) of the SARFAESI Rules, to you all l as under:

As you all are aware that the secured creditor had issued the Demand Notices, under Section 13(2) of the Act. on 29/11/2023 (date of Demand Notice), to the borrower/ firm M/S Cameravalas (Proprietor Mr. Ananda Birendra Chakravarti), Mr. Ananda Birendra Chakravarti, Mrs. Ritu Wadhwa (name of Borrower/ Mortgagor/Guarantor), the mortgagor and the guarantors (above mentioned names), demanding to pay an amount of Rs. 1,15,33,692.35 (Rupees One crore fifteen lakh thirty three thousand six hundred ninety two rupees and thirty five paise only) and interest stated thereon within 60 days from the date of receipt of the said notices.

Since, the Borrowers / Firm, the mortgagors and the Guarantor (above mentioned names) having failed to repay the amount mentioned in the above said demand notices, the Authorized Officer under Section 13(4) of the Act had taken symbolic/Physical possession of the secured assets described in the Possession Notice dated 29/02/2024 . Further, the said symbolic/ Physical possession notice was duly published in Navrashtra (Name of newspaper in local language) and Financial Express (Name of English Newspapers) newspapers on 05/03/2024 (Date of publication) To comply with the provision of SARFAESI Act, 2002 read with Rule 8(6) of SARFAESI Rules, you all

are hereby given a last and final opportunity to redeem and reclaim the secured assets, which are in possession of the secured creditor, within 30 days from the receipt of this notice, by discharging the liability of Rs. 1,15,33,692.35 (Rupees One crore fifteen lakh thirty three thousand six hundred ninety two rupees and thirty five paise only) as on 29/11/2023, plus subsequent interest, costs and expenses in full, failing which the sale notice under the Act will be published in the newspaper specifying one of the following modes mentioned below, to sell the secured assets: . By obtaining quotations from the persons dealing with similar secured assets or otherwise

interested in buying assets; **or** ii. By inviting tenders from the public; **or** iii. By holding public auction including through e-auction mode; **or** iv. By private treaty. As per Section 13(8) of the Act, you are entitled to redeem the secured Assets at any time before the date of publication of sale notice in Newspapers, failing which your Right to redeem the mortgaged property as per Section 13(8) of the Act shall stand extinguished. This is without prejudice to any other rights available to the secured creditor under the subject Act/ or any other law in force.

> Thanking You CANARA BANK Sd/- AUTHORISED OFFICER

## केनरा बैंक Canara Bank सिंदिकेट Syndicate

Recovery Section, Navi Mumbai Regional Office: Circle Office Building, 8th Floor, 'A' Wing, C-14, G Block, BKC, Bandra East, Mumbai-400 051, Email: recoveryronm@canarabank.com Ref. No. BR/15496/13-2/2017 Dated: 31/10/2024

To the Borrower/Guarantors/Mortgagor:

Mrs. RADHIKA SAHANI

referred to as "the Act").

any other law in force.

Regd. Post with Ack. Due

Flat No. 102, 1st Floor, Building Name "Silver Dhara", Plot No 30, Sector 20, Taloja, Navi Mumbai, Taluka Panvel, District Raigad, Maharashtra - 410206 SUBJECT: Notice for exercising the right of redemption under Section 13 (8) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (hereinafter

The undersigned being the Authorized Officer of Canara Bank, Regional Office, Navi Mumbai, Maharashtra (hereinafter referred to as "the secured creditor"), appointed under the Act do hereby issue this notice, under Section 13(8) of the Act read with Rule 8(6) of the SARFAESI Rules, to you all as under:

As you all are aware that the secured creditor had issued the Demand Notices, under Section 13(2) of the Act. on 24/07/2017 (date of Demand Notice), to the borrower/ firm Mrs. RADHIKA SAHANI (name of Borrower/ Mortgagor/Guarantor), the mortgagor and the guarantors (above mentioned names), demanding to pay an amount of Rs. 20,99,148.00 (Rupees Twenty lakh ninety nine thousand one hundred forty eight rupees only) and interest stated thereon within 60 days from the

date of receipt of the said notices. Since, the Borrowers / Firm, the mortgagors and the Guarantor (above mentioned names) having failed to repay the amount mentioned in the above said demand notices, the Authorized Officer under Section 13(4) of the Act had taken symbolic/Physical possession of the secured assets described in the Possession Notice dated 11/10/2017 . Further, the said symbolic/ Physical possession notice was duly published in Tarun Bharat (Name of newspaper in local language) and Business Standard

(Name of English Newspapers) newspapers on 17/10/2017 (Date of publication)

To comply with the provision of SARFAESI Act, 2002 read with Rule 8(6) of SARFAESI Rules, you all are hereby given a last and final opportunity to redeem and reclaim the secured assets, which are in possession of the secured creditor, within 30 days from the receipt of this notice, by discharging the liability of Rs. 20,99,148.00 (Rupees Twenty lakh ninety nine thousand one hundred forty eight rupees only) as on 24/07/2017, plus subsequent interest, costs and expenses in full, failing which the sale notice under the Act will be published in the newspaper specifying one of the following modes

mentioned below, to sell the secured assets: i. By obtaining quotations from the persons dealing with similar secured assets or otherwise interested in buying assets; **or** ii. By inviting tenders from the public; **or** iii. By holding public auction including through e-auction mode; **or** iv. By private treaty.

As per Section 13(8) of the Act, you are entitled to redeem the secured Assets at any time before the date of publication of sale notice in Newspapers, failing which your Right to redeem the mortgaged property as per Section 13(8) of the Act shall stand extinguished.

This is without prejudice to any other rights available to the secured creditor under the subject Act/ or

**CANARA BANK** 

**AUTHORISED OFFICER** 

# केनरा बैंक Canara Bank िसिंडिकेट Syndicate

Recovery Section, Navi Mumbai Regional Office: Circle Office Building, 8th Floor, 'A' Wing, C-14, G Block, BKC, Bandra East, Mumbai-400 051. Email: recoveryronm@canarabank.com Ref. No. RO/LEGAL/SARFAESI/1/2020/SV

Dated: 11/11/2024 Regd. Post with Ack. Due

To the Borrower/Guarantors/Mortgagor: 1. M/S GRASIM INTERNATIONAL PROP: - RAJESH RAMAKANT GUPTA DFFICE NO. 303, K 3RD FLOOR, BUILDING NO 3, MILLENIUM BUSINESS PARK, MAHAPE, NAVI

MUMBAI - 400710 2. MR. RAJESH RAMAKANT GUPTA (PROPRIETOR OF M/S GRASIM INTERNATIONAL) ROOM NO 02 GAJANAN CO OP HOUSING SOCIETY, SECTOR NO 02 AIROLI, NAVI MUMBAI, THANE -

3. M/S KEEP WHITE TRADING PRIVATE LIMITED

OFFICE NO 610, 6TH FLOOR, CENTRAL FACILITY BUILDING FRUIT MARKET PLOT NO 3&7, GAT NO

796. SECTOR 19 TURBHE, NAVI MUMBALTAL & Dist THANE-400703. 4. M/S GRASIM INTERNATIONAL PROP:- RAJESH RAMAKANT GUPTA OFFICE NO 610, 6TH FLOOR, CENTRAL FACILITY BUILDING FRUIT MARKET PLOT NO 3&7, GAT NO

796, SECTOR 19 TURBHE, NAVI MUMBAI TAL & Dist THANE-400703. SUBJECT: Notice for exercising the right of redemption under Section 13 (8) of the Securitisation and

Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (hereinafter

The undersigned being the Authorized Officer of Canara Bank, Regional Office, Navi Mumbai, Maharashtra (hereinafter referred to as "the secured creditor"), appointed under the Act do hereby issue this notice, under Section 13(8) of the Act read with Rule 8(6) of the SARFAESI Rules, to you all

As you all are aware that the secured creditor had issued the Demand Notices, under Section 13(2) of the Act, on 02/05/2024 (date of Demand Notice), to the borrower/ firm M/S GRASIM INTERNATIONAL, MR. RAJESH RAMAKANT GUPTA, M/S KEEP WHITE TRADING PRIVATE LIMITED (name of Borrower/ Mortgagor/Guarantor), the mortgagor and the guarantors (above mentioned names), demanding to pay an amount of Rs. 3,19,00,000.00 (Rupees Three crore **nineteen lakh rupees only)** and interest stated thereon within 60 days from the date of receipt of the said notices.

Since, the Borrowers / Firm, the mortgagors and the Guarantor (above mentioned names) having failed to repay the amount mentioned in the above said demand notices, the Authorized Officer under Section 13(4) of the Act had taken symbolic/Physical possession of the secured assets described in the Possession Notice dated 25/07/2024 . Further, the said symbolic/ Physical possession notice was duly published in Navshakti (Name of newspaper in local language) and Free Press Journal (Name of English Newspapers) newspapers on 27/07/2024 (Date of publication)

To comply with the provision of SARFAESI Act, 2002 read with Rule 8(6) of SARFAESI Rules, you all

are hereby given a last and final opportunity to redeem and reclaim the secured assets, which are in possession of the secured creditor, within 30 days from the receipt of this notice, by discharging the liability of Rs. 3,19,00,000.00 (Rupees Three crore nineteen lakh rupees only) as on 02/05/2024, plus subsequent interest, costs and expenses in full, failing which the sale notice under the Act will be published in the newspaper specifying one of the following modes mentioned below, to sell the

secured assets: i. By obtaining quotations from the persons dealing with similar secured assets or otherwise interested in buying assets; **or** ii. By inviting tenders from the public; **or** iii. By holding public auction including through e-auction mode; **or** iv. By private treaty.

As per Section 13(8) of the Act, you are entitled to redeem the secured Assets at any time before the date of publication of sale notice in Newspapers, failing which your Right to redeem the mortgaged property as per Section 13(8) of the Act shall stand extinguished.

This is without prejudice to any other rights available to the secured creditor under the subject Act/ or any other law in force. Thanking You

CANARA BANK

AUTHORISED OFFICER

Place : Bengaluru

Date: 13.11.2024

TRESCON

**Trescon Limited** 

CIN: L70100MH1995PLC322341 Regd Office: 301, Third Floor, Skyline Wealth Space, Nathani Road, Vidyavihar (West), Mumbai - 400 086 Email: cs@trescon.com | Website: www.trescon.com | Tel: 022 - 46165611 Extract of Standalone and Consolidated Un-Audited Financial Results

for the guarter and half year ended on September 30, 2024

STANDALONE **CONSOLIDATED** Quarter Half Year Ended ended Year Ended Quarter Ended Year Ended Quarter Half Year ended Ended **Particulars** 31.03.2024 30.06.2024 30.09.2024 31.03.2024 30.09.2024 30.06.2024 30.09.2024 30.09.2024 Unaudited Unaudited Unaudited Audited Unaudited Unaudited Audited Total Revenue 136.74 272.49 461.94 82.18 76.87 159.05 461.94 274.74 111.13 161.99 273.12 209.16 Total Expenses 110.66 164.09 209.16 Net Profit before Tax -28.95 -85.12 252.77 -27.35 -2.26 252.77 -114.07 25.09 Net Profit after Tax 23.28 -34.31 -11.03 -30.76 -100.24 -123.71 141.82 141.82 Other Comprehensive Income Total Comprehensive Income for the period (after tax) -34.31 -11.03 141.82 -30.76 -100.24 -123.71 141.82 23.28 Equity Share Capital (Paid up) 7077.17 7077.17 7,077.17 7,077.17 7077.17 7077.17 | 7,077.17 | 7,077.17 Reserves (excluding revaluation reserve) as shown 3790.97 in the Audited Balance Sheet of the previous year

Earnings per Share - Basic and Diluted (Rupees) 0.03 -0.05 -0.02 0.20 -0.06 -0.14 Notes: The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the websites of the Stock Exchange and the Company - https://www.trescon.com/investors-section/financial-results.htm For and on behalf of the Board of Directors **Trescon Limited** 

Mumbai, November 12, 2024

(PICICI Home Finance | Corporate Office: ICICI HFC Tower, Andheri Kurla Road, J.B. Nagar, Andheri (E), Mumbai - 400 059. Branch Office: ICICI Home Finance Co. Ltd., HFC Tower, Andheri Kurla Road, J. B. Nagar, Andheri (E), Mumbai-400059

[SEE PROVISO TO RULE 8(6)] NOTICE FOR SALE OF IMMOVABLE ASSETS E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest

(Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the Possession of which has been taken by the Authorized Officer of ICICI Home Finance Company Ltd., will be sold on "As is where is", "As is what is", and "Whatever there is", as per the brief particulars given hereunder;

Reserve Price Date and Date & One Day SARFAES Name of Borrower(s) / Details of the Secured Amount asset(s) with known Outstanding Earnest Time of Time of Before Co Borrowers / Stage Guarantors/Legal Heirs. Money Property Auction Auction encumbrances, if any Loan Account No. Deposit Date nspection (D) (E) (F) (H) Javed Rashid Khan Rs. Rs. 22nd 29th 28th Symbolic Flat No. 33 on third (Borrower) Shabana floor of building No. 15, 76,59,071 97,35,390 Nov,'24 Nov. Nov. Possessi Larsen & Tourbo Group 24 24 11AM Javed Khan (as on on Rs. 3РМ 2PM Co-Borrower) of Companies 9,73,539/-HMUM00001293487 Employees Co-operative November **3PM** & LHMUM00001293488 Hsg. Soc. Ltd., CTS No. & NHMUM00001293486 10, Vijay Nagar, Marol Maroshi road, Marol, Andheri (East) Mumbai - 400059

The online auction will be conducted on website (URL Link- https://assets.matexauctions.com) of our auction agency Matex Net Pvt Ltd.. The Mortgagors/ notice are given a last chance to pay the total dues with further interest till 28th Nov.'24 before 5.00 PM else these secured assets will be sold as per above schedule. The Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) RTGS/ Demand Draft (DD) (Refer Column E) at ICICI Home Finance Company Limited Branch Office Address mentioned on top of the article on or before 28th Nov.'24 before 04:00 PM. The Prospective Bidder(s) must also submit signed copy of Registration Form & Bid Terms and Conditions form at ICICI Home Finance Company Limited Branch Office Address mentioned on top of the article on ar before 28th Nov, '24 before 05.00 PM. Earnest Money Deposit Demand Draft (DD) should be from a Nationalized/Scheduled Bank in favor of "ICICI Home Finance Company Ltd. - Auction" payable at the branch office address mentioned on top of the article.

For any further clarifications with regards to inspection, terms and conditions of the auction or submission of tenders, kindly contact ICICI Home Finance Company Limited on 9920807300.

The Authorized Officer reserves the right to reject any or all the bids without furnishing any further reasons. For detailed terms and conditions of the sale, please visit https://www.icicihfc.com/

Date: 14.11.2024 Authorised Officer, ICICI Home Finance Company Limited Place : Mumbai CIN: U65922MH1999PLC120106

## SUPERTEX INDUSTRIES LIMITED

Regd.Off.: Plot No.45, Phase II Piperia Industrial Estate, Silvassa (D&NH.) Tel:+91 22 22095630 | Website: www.supertex.in | E-Mail: info@supertex.in | CIN: L99999DN1986PLC000046 STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS

FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2024

Sr.	Particulars	a	uarter ende	ed	Half Year	Year Ended	
No.		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
policy		30-Sep-24	30-Jun-24	30-Sep-23	30-Sep-24	30-Sep-23	31-Mar-24
1 2	Total income from operations (net) Net Profit / (Loss) for the period	1,242	2,930	2,682	4,173	3,766	9,082
3	(before Tax and Exceptional items) Net Profit / (Loss) for the period before Tax	6	9	(6)	15	1	32
4	(after Exceptional items) Net Profit / (Loss) for the period after Tax	6	9	(6)	15	1	32
- C	(after Exceptional items)	56	(4)	(1)	52	(7)	11
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	54	(5)	(3)	49	(10)	17
6	Paid-up Equity Share Capital (Face Value of Rs. 10/- each)	1,134	1,134	1,134	1,134	1,134	1,134
7	Reserves (excluding Revaluation Reserve as shown	20000000	700,000,000	50050111	20050537	MARKE I	
8	in the Balance Sheet of previous year) Earnings Per Share (of Face Value of Rs. 10/- each) (for continuing and discontinued operations)	3,056	3,002	2,979	3,056	2,979	3,007
	Basic (in Rs/p) Diluted (in Rs/p)	0.48 0.48	(0.04)	(0.01)	0.43 0.43	(80.0) (80.0)	0.15 0.15

Note: The above is an extract of the detailed format of Unaudited Financial Results for the Quarter and Half year ended 30th September 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015. The full format of the Unaudited Financial Results for the Quarter and Half year ended 30th September, 2024 are available on the stock exchange website namely BSE Ltd at www.bseindia.com and also on the website of the Company at www.supertex.in.

For Supertex Industries Limited

Place: Mumbai Date: 12" November, 2024

R. K. Mishra Chairman & Managing Director

/De in Lakhal

MURUDESHWAR CERAMICS LTD.

Regd. Office: 604/B, Murudeshwar Bhavan, Gokul Road, Hubli - 580 030 Ph: (0836) 2331615-18; Fax: (0836) 4252583;

E-mail: mclho@naveentile.com; Web: www.naveentile.com

CIN: L26914KA1983PLC005401

## CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30.09.2024

SI. No.	Particulars	Quarter ending 30.09.2024	Year to date Figures 30.09.2024	Previous year quarter ended 30.09.2023
1.	Total Income from Operations	4,462.05	8,828.66	4578.88
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extra-ordinary items)	271.37	464.94	192.78
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extra-ordinary items)	271.37	464.94	192.78
4.	Net profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extra-ordinary items)	269.52	461.24	119.77
5.	Share of Profit (Loss) of Associates Accounted for using Equity Method	21.23	30.69	6.62
6	Other comprehensive income	-	54	
7	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive income (after tax)]	290.75	491.93	126.39
8	Equity Share Capital	6,054.53	6,054.53	5,769.53
9	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	30,416.96	30,416.96	29,164.88
10	Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -  1. Basic :	0.48	0.81	0.22
	2. Diluted :	0.48	0.81	0.2

 The above results for the quarter ended 30th September, 2024 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in their meeting held on 13.11.2024 and Statutory Auditors of the Company have carried out a

2.	Stand Alone Financial Result;	Quarter ended 30.09.2024	Year to date Figures 30.09.2024	Previous year Quarter ended 30.09.2023
	Income from Operation	4,462.05	8,828.66	4,578.88
	Profit Before Tax	271.37	464.94	192.78
	Profit After Tax	269.52	461.24	119.77

- 3. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015, The full format of the Quarterly Financial Results are available in the Stock Exchange websites namely: www.bseindia.com (BSE), www.nseindia.com (NSE) and Company website: www.naveentile.com
- 4. The Company is holding 26.10% Equity Shares of RNS Power Ltd (RNSPL). Thus RNSPL become an associate company in terms of section 2(6) of the companies Act, 2013. Accordingly, in terms of section 129, consolidated financial statement of the company has been prepared with RNSPL.
- The previous periods figures have been re-grouped / re-classified wherever necessary. By Order of the Board of Directors For MURUDESHWAR CERAMICS LIMITED

Satish R Shetty Chairman & Managing Director DIN: 00037526

SHYAMA COMPUTRONICS AND SERVICES LIMITED

(FORMERLY KNOWN AS : SHYAMA INFOSYS LIMITED) Regd office: 3rd Floor, Plot-395/397, Ruia Building Kalbadevi Road, Dabhol Karwadi. Kalbadevi Mumbai Mumbai City MH 400002 INDIA CIN: L24235MH1996PLC057150

Website: www.shyamainfosysltd.co.in Telephone: 033-22420751

Extract of the Un-Audited Standalone Financial Results for the Quarter and Half Year Ended 30th September 2024. (Rs. in Lakhs)

Particulars	Quarter ended 30.09.2024 (Un-Audited)	Corresponding Quarter ended 30.09.2023 (Un-Audited)	Half Year ended 30.09.2024 (Un-Audited)	Corresponding Half Year ended 30.09.2023 (Un-Audited)	Year ended 31.03.2024 (Audited)
Total Income From Operations (Net)	8.50	7.63	21.39	18.12	38.65
Net Profit for the period ( before Tax, Exceptional items and / or Extraordinary items)	2.65	1.80	4.56	2.57	12.91
Net Profit for the period before Tax( after Exceptional items and / or Extraordinary items)	2.65	1.80	4.56	2.57	12.91
Net Profit for the period after Tax (after Exceptional items and / or Extraordinary items)	1.96	1,33	3.38	1.90	10.99
Total Comprehensive Income for the period after Tax	1.96	1,33	3.38	1,90	10.99
Equity Share Capital	1006,44	1006.44	1006.44	1006.44	1006.44
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-7.71	-19.83	-7.71	-20.39	-21.09
Earnings Per Share (before and after extraordinary items) (Face value of Rs. 10/-each)	0.02	0.01	0.03	0.02	0.11
(a) Basic (Rs.)					
(b) Diluted (Rs.)					

Place: Kolkata

(Rs in Lakhs)

Date: 12.11.2024

(₹ In lakhs)

**Dinesh Patel** 

DIN: 00462565

**Managing Director** 

The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on

The above is an extract 1 of the detailed format of the Results for Quarter and Half Year ended on 30th September, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone Un audited Financial Results for the Quarter and Half Year ended 30th September, 2024 is available on the Stock Exchange website www.bseindia.com and on the Company's website - www.shyamainfosysltd.co.in

For and on behalf of the Board of Directors

Mr. Samir Biswas Managing Director DIN: 07834496

Registered Office: Solitaire Corporate Park, Building No. 4, 6th Floor, Guru Hargovindji Road, Chakala, Andheri (East), Mumbai - 400093.

Tel. No.: 022-66572700, Website: www.sicomindia.com

PUBLIC E-AUCTION CUM SALE NOTICE

## Notice is hereby given to the public in general and Borrowers / Mortgagors and Guarantors in particular by SICOM LIMITED ('SICOM')

that possession of the under mentioned property/ies mortgaged to SICOM on which SICOM has an exclusive charge was taken under the provisions of Section 13(4) of The Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 [SARFAESI Act] and will be sold on a "as is where is, as is what is, whatever there is without recourse basis and without any warranty and indemnity" for recovery of SICOM's dues from M/s. Baker Technical Services Pvt. Ltd., Narang Developers Pvt. Ltd. and Shree Balaji Homes Pvt. Ltd. (Borrowers) through public E-Auction on December 18, 2024 between 11:30 a.m. and 03:00 p.m., at https://eauction.auctiontiger.net. Offers are invited in a sealed envelope along with Earnest Money Deposit (EMD) payable by Demand Draft of Nationalized Bank / Scheduled Commercial Bank or NEFT/RTGS from interested parties in respect of the below mentioned property.

Lot Nos.			Description of Property	Reserve Price (Rs. in Crs.)	Earnest Money Deposit (Rs. in Crs.
Lot 1	3300 sq. eet or thereabouts as "Narang Manor" construc F/454/B at 15 <sup>th</sup> Road, Bandra corporation of Greater Mum	sale tec a (V ibai ged	t admeasuring 2000 sq.feet carpet area equivalent to eable area on the entire First floor of the building known on the plot of the land bearing Plot No. 96-B, CS No. Vest), Mumbai - 400050 within the limits of the Municipal, Taluka Bandra, District and Registration Sub-District by Baker Technical Services Pvt. Ltd. Mortgagor's ces Pvt. Ltd.	8.55	0.85
Lot 2	admeasuring 400 sq.feet equivalent to 3000 sq.feet o building known as "Narang N 96-B, CS No. F/454/B at 15 <sup>th</sup> the Municipal corporation of	car r th /lar Ro Gr	at admeasuring 1300 sq.feet carpet area + terrace pet area aggregating to 1700 sq.feet carpet area ereabouts saleable area on the entire Fifth floor of the lor constructed on the plot of the land bearing Plot No. ad, Bandra (West), Mumbai - 400050 within the limits of eater Mumbai, Taluka Bandra, District and Registration mortgaged by Sunita D. Narang. Mortgagor's Name:	7.01	0.70
2000 sq.feet or thereabouts as "Narang Manor" constru F/454/B at 15th Road, Bandi corporation of Greater Mur			t admeasuring 1200 sq.feet carpet area equivalent to eable area on the entire Sixth floor of the building known on the plot of the land bearing Plot No. 96-B, CS No. Vest), Mumbai - 400050 within the limits of the Municipal, Taluka Bandra, District and Registration Sub-District by Dilip Narang. Mortgagor's Name: Dilip Narang	5.69	0.57
Borrower's	s Name	:	Baker Technical Services Pvt. Ltd., Narang Developer	s Pvt. Ltd., Shree	Balaji Homes Pvt. Ltd
	Outstanding dues + Interest) to be recovered	:	*Rs. 56.36 Crores (Principal + Interest) as on September 30, 2024 (with further interest hereo	n)	
Date and Time of Inspection  Date and time of E-Auction			22 <sup>nd</sup> November 2024 between 11:00 a.m. to 04:00 p.m	1.	
			18th December 2024         Lot 1       11:30 a.m. to 12:30 p.m.         Lot 2       12:45 p.m. to 01:45 p.m.		

(POD Rs.5.65 crs. IOD Rs. 19.60 crs); Shree Balaii Homes Pvt. Ltd. (POD Rs.5.65 crs, IOD Rs. 20.12 crs); Narang Developers Pvt. Ltd. (POD Rs 1.50 crs, IOD Rs. 3.85 crs) as on 30th September 2024. TERMS AND CONDITIONS OF AUCTION:

The assets are available for purchase in separate lots (Lot 1, Lot 2 & Lot 3) as mentioned above. Bidder may submit his / her /

their offer / bid for each lot separately along with separate EMD for each Lot. 2. The bid increase amount will be Rs. 5,00,000/- and in multiples thereof.

Lot 2

3. Prospective bidders may avail online training from service provider M/s. e-Procurement Technologies Ltd. (Auction Tiger) and Mr. Ram Sharma (Mobile No. 8000023297, E-mail ID- ramprasad@auctiontiger.net), Helpline E-mail ID: support@auctiontiger.net. Prospective bidders are advised to visit website www.auctiontiger.in for detailed terms & conditions and procedure of sale before submitting

their bids. The auction sale is subject to the General Terms and Conditions of sale of the above mentioned property, a separate copy whereof can be obtained by bidders from www.sicomindia.com or www.auctiontiger.in. Even if the bidder does not obtain the copies of the General Terms and Conditions of sale, it would be presumed that the bidder has obtained, perused, examined and accepted the same. For participating in the public auction, the intending bidders / offerors shall have to deposit the Earnest Money Deposit (EMD) in the

following manner by way of Demand Draft drawn on Nationalized Bank/Scheduled Commercial Bank in favour of 'SICOM LIMITED' payable at Mumbai to be submitted by 16th December, 2024 upto 04:00 p.m. EMD (Rs. in Crs.) Lot 1 0.85

2013	0.37
EMD as mentioned may also be deposited through RTGS / NEFT by	16th December, 2024 upto 04:00 p.m as per schedule given below
in the account as per details as under:	8
Beneficiary Name	SICOM Limited
Beneficiary Bank Name	HDFC Bank, Shankar Nagar Branch, Nagpur
Beneficiary Account No.	01020350000178

0.70

**Branch Address** Shankar Nagar Branch, Nagpur IFSC Code HDFC0000102 The successful bidders/purchasers are advised to adhere payment schedule as under

a. A further payment of 25% of the offer amount (less amount paid as EMD as above) to be paid immediately or not later than the next working day on confirmation of sale by SICOM, by RTGS/NEFT or by way of Demand Draft drawn on any Nationalised Bank/Scheduled Commercial Bank payable at Mumbai in the name of SICOM Ltd. The balance amount of 75% of the purchase price shall be paid on or before 15 days (fifteen days) from the date of acceptance and confirmation of offer by SICOM and if 15th day is Sunday or other Holiday, then on immediate next working day.

8. The offer which is not accompanied with accepted and signed copy of General terms and conditions and requisite EMD or offer received after the above date & time or below reserve price prescribed herein will not be considered/ treated as valid tenders and shall accordingly

9. SICOM is not bound to accept the highest offer or any offer and may accept any offer or reject all as it shall, in its absolute discretion deems fit 10. The sale shall be subject to the final approval by the management of SICOM Ltd. 11. SICOM Ltd reserves the right to cancel / postpone the public auction process at any point without assigning any reason thereof

12. The above-mentioned mortgaged property is being sold on "As is where is, as is what is, whatever there is without recourse basis and without any warranty and indemnity". 13. To the best of the knowledge and information of SICOM Ltd, no encumbrance exists on the property save and except of SICOM. The bidder shall make himself / herself / their satisfied in all aspects, including but not limited to any charge, lien, taxes or any other dues. The bidder is

for any charge, lien, encumbrance, property tax or any other dues to anybody in respect of the property/ies under the sale. All statutory liabilities / taxes / maintenance, fee / electricity / water charges & municipal charges, etc. outstanding as on date and yet to fall due would be ascertained by the bidder(s) and would be borne by the successful bidder / purchaser. SICOM Ltd. does not take any responsibility to provide information on the same nor to pay any charges on the mortgaged property/ies of whatsoever nature.

further advised to carry out his / her / their own due-diligence with regards to the said property/ies. SICOM Ltd. will not be held responsible

14. It shall be the responsibility of the Purchaser / successful bidder to ascertain and pay GST (Goods and Service Tax) which should be over and above the price offered by the successful bidder / purchaser.

15. It shall be the responsibility of the Purchaser / successful bidder to pay 1% (One percentage) of the sale consideration towards Income Tax u/s 194 I A of the Income Tax Act. Such Income Tax shall be paid by the purchaser / successful bidder over and above the price offered by purchaser / successful bidder to SICOM and SICOM shall get the offer / bid price without it being subjected to any type / sort of deduction therefrom 15. Schedule of auction is as under:-

П	1	Inspection of property	22 <sup>nd</sup> November 2024, from 11:00 a.m. to 04:00 p.m.				
		Last date for receiving bids alongwith earnest money and uploading documents including proof of payment	16th December 2024, up to 04:00 p.m. (for both – DD or RTGS/NEFT)				
П	3	Public E-auction: Date and Time	18th December 2024				
П			Lot 1 11:30 a.m. to 12:30 p.m.				
П			Lot 2 12:45 p.m. to 01:45 p.m.				
Ш	L.		Lot 3 02:00 p.m. to 03:00 p.m.				
П		FOR FURTHER DETAILS AND TE	RMS & CONDITIONS OF SALE PLEASE CONTACT				
П	Mr.	Rajendra Bhosale Tel. No.: (022)-66572724, Mo	bile- 9833546349, E-mail: rbhosale@sicomindia.com				
1.1	2.0						

Tel. No.: (022)-66572706, Mobile- 9323554697, E-mail: ovedak@sicomindia.com Mr. Omkar Vedak NOTICE TO BORROWER / MORTGAGOR/ GUARANTOR

Rules, 2002 to pay the dues as above and interest with monthly rests, costs and charges etc. on or before the date of auction sale, failing which the property will be auctioned / sold on the date and time as mentioned above and balance dues, if any, will be recovered with interest and cost from them respectively.

Date: 14th November, 2024 Place: Mumbai Authorized Officer, SICOM Limited

This is also notice to the borrower / mortgagor and guarantor in the above said account under Rule 8(6) of the Security Interest (Enforcement)

financialexp.epapr.in

# પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ચાંદલોડિયા રેલવે સ્ટેશન ખાતે જન ઔષધિ કેન્દ્રનું વર્ચ્યુઅલી લોકાર્પણ



મોદીના હસ્તે તારીખ ૧૩ નવેમ્બર કરવામાં આવેલ ચાંદલોડિયા ખાતેના ૨૦૨૪ ના રોજ દરભંગા, બિહાર જનઔષધી કેન્દ્ર થકી મુસાફરો અને ખાતેથી ચાંદલોડિયા રેલ્વે સ્ટેશન અને ગુજરાત રાજ્યના વાપી, રાજકોટ ઉત્પાદનોની ઝડપી પહોંચની સુવિધા સહિત સમગ્ર ભારતમાં ૧૮ સ્થળોએ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ

અમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર કરવામાં આવ્યું હતું. નિર્માણ મુલાકાતીઓ ને જનઔ ષધિ મળશે. સસ્તી આરોગ્ય સંભાળના સરકારના વિઝન સાથે જોડાયેલા આ કેન્દ્રો (PMBJKs)નું વર્ચ્યુઅલ લોકાર્પણ જન ઔષધી કેન્દ્ર પર ૫૦ થી ૯૦%

## અજમેર મંડળ પર બ્લોકને કારણે સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

અમદાવાદ, ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળના નાના-કેશવગંજ સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર ૭૧૭ કિમી ૫૪૦/૬-૭ પર આરસીસી બોક્સ લોંચિંગ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-

૧૪ અને ૧૫ નવેમ્બર ૨૦૨૪ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર ૧૪૮૨૧ જોધપુર-સાબરમતી એક્સપ્રેસ રદ રહેશે.

૧૫ અને ૧૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર ૧૪૮૨૨ સાબરમતી-જોધુપર એક્સપ્રેસ રદ રહેશે.

ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૂપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

## ''ધ સ્ટાર્ટ-અપ પ્લેબુકઃ ભારતની ઉદ્યોગસાહસિકતાની ઇકોસિસ્ટમમાં સફળતાનું જતન"



અમદાવાદ, જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં ભારતમાં ૧,૩૦,૦૦૦થી માટે જૂજ સ્ટાર્ટ-અપ્સ જ અત્યંત સફળ છે.

આનો જવાબ એ સમજમાંથી મળે

સરળ હોય છે. સમજદાર ઉદ્યોગસાહસિકો જાણે છે કે ખરો પડકાર તો એવી કંપની બનાવવામાં રહેલો છે જે તેના ગ્રાહકોને મૂલ્ય પૂરું પાડે અને રોકાશકારો તથા શેરધારકો બંનેને લાભ કરે તે રીતે અસરકારક પ્રગતિ કરે. ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, બોમ્બેની ટેક્નોલોજી બિઝનેસ ઇક્ર્યુબેટર એવી સોસાયટી ઇનોવેશન એન્ડ ઓફ વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટ-અપ્સ ઊભા આંત્રપ્રિન્યોરશિપ (એસઆઈએનઈ) થઈ ચૂક્યા છે. આમ છતાં તે પૈકીના ખાતે અમે આ પ્રક્રિયાને નજીકથી લગભગ ૧૧૦ જ યુનિકોર્નનું સ્ટેટસ નિહાળી છે. એસઆઈએનઈએ મેળવી ચક્ચા છે જેનું વેલ્યએશન એક ૨૪૦થી વધ સ્ટાર્ટ-અપ્સ અને અબજ ડોલર કરતાં વધુ હોય. મતલબ ૧,૦૦૦થી વધુ ફાઉન્ડર્સને મદદ કરી કે દર ૧,૨૦૦ સ્ટાર્ટઅપ્સમાંથી માત્ર છે. અમારી ઇક્ર્યુબેટેડ કંપનીઓમાં એકને જ આ પ્રતિષ્ઠિત સીમાચિક્ષ સફળતાનો દર પ્રભાવશાળી એવો હાંસલ થયું છે. આના લીધે એક ૭૫ ટકા જેટલો છે જેની સામે મહત્વનો સવાલ ઊભો થાય છેઃ શા ઉદ્યોગની સરેરાશ ૧૦ ટકા જેટલી જ

છે કે બિઝનેસ શરૂ કરવો એકંદરે

## કેડિલા ફાર્માસ્યુટિકલ્સે નવી આયર્ન સપ્લિમેન્ટ 'મિલિટોલ' લોન્ચ કરી



અમદાવાદ, ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગમાં અગ્રેસર કેડિલા ફાર્માસ્યુટિકલ્સે નવીન આયર્ન

મિલિટોલમાં ફોલિક એસિડ રેડ બ્લડ સેલ્સને બનાવવા. વિટામિન મ્૧૨ ન્યુરોલોજીકલ હેલ્થ અને રેડ સેલ્સ બનાવવા, વિટામીન C આયર્ન અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અને વિટામિન D કેલ્શિયમ વધારવા અને હાડકા મજબૂત કરવામાં મદદરૂપ થશે. મિલિટોલ ફેરિક આયર્ન માલ્ટોલના નોન-સોલ્ટ કોમ્પલેક્સને જોડીને, આયર્ન સપ્લિમેન્ટ્સ સાથે સપ્લિમેન્ટ 'મિલિટોલ' લોન્ચ કરી સંકળાયેલ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ આડ છે, જે પૂરતા પોષક તત્વો પૂરા અસરોને ઓછી કરે છે. મિલિટોલ પાડવા માટે તૈયાર કરાયેલ છે. જે ફોલિક એસિડ અને વિવિધ આયર્નની ઉણપને દૂર કરે છે. વિટામિન્સના વ્યાપક પોષક તત્વોનો મિલિટોલ ચોક્કસ ઘટકોનો ઉપયોગ સ્ત્રોત છે, જે પૂરકતા માટે સર્વગ્રાહી કરીને કાળજી પૂર્વક તૈયાર કરાયેલ અભિગમ પ્રદાન કરે છે. ફોર્મ્યુલેશન છે, જે આયર્ન સ્ત્રોતને વધારીને આયર્નના શોષણમાં વધારો કરે છે, આરોગ્યમાં સુધારો કરશે. અને પોષક તત્વોના સ્પેક્ટ્રમને પણ સપ્લિમેન્ટમાં ફેરિક માલ્ટોલ છે, જે સમર્થન આપે છે, જે દર્દીઓ માટે માલ્ટોલ સાથે સંકલિત ફેરિક અત્યંત અસરકારક છે. (૧૯-૧)

આયર્નનો નવીન લો-ડોઝ છે.

Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLIATION PVT. LTD. and Printed at : Dharti Printers C-3, Shankar Chember, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLIATION PVT. LTD. 201,202,208 Nandan complex, opp mithakhali rly crossing, mithakhali, ahmedabad. Editior: Mayur C. અને સામાન્ય જનતાને સુલભતા પ્રદાન કરી જેનેરિક દવાઓ પ્રત્યે જાગતિ લાવી પ્રોત્સાહિત કરવામાં આવશે, સાથે જ PMBJKના સંચાલન તકોનું સર્જન થશે.

અમદાવાદ મંડળના વરિષ્ઠ મુસાફરો માટે આશીર્વાદરૂપ બનશે. જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મહાનુભાવોને સાલ અને બુકે આરોગ્ય ક્ષેત્રે પ્રધાનમંત્રી આયુષ્માન આપીને કરવામાં આવ્યો હતો. સર્વે યોજના તથા જન ઔષધિ કેન્દ્ર મહાનુભાવોના હસ્તે ચાંદલોડિયા યોજના તેમની સંવેદનશીલતાના પ્રમુખ ઉદાહરણ છે. ૫૦૦૦ કરતાં લોકોને સસ્તી અને ગુણવત્તાલક્ષી દવાઓ મળી રહી છે. ત્યારે રેલ્વેને પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રી ડૉ. જન ઔષધિ યોજના સાથે જોડતા હર્ષદભાઈ પટેલ. શહેરના વિવિધ મુસાફરો તેમજ શહેરીજનોને પણ જીવન આવશ્યક ગુણવત્તાલક્ષી દવાઓની સુવિધાઓ મળશે. જન ઔષધી કેન્દ્ર પરથી મળતી દવાઓ

સુધી ઓછી કિંમતમાં સસ્તી દવાઓ મળે છે તેની ગુણવત્તા સાથે કોઈ જ ું ઉપલબ્ધ થશે. કેન્દ્ર દ્વારા પ્રવાસીઓ સમાધાન કરવામાં આવતું નથી. જન ઔષધિ કેન્દ્રના માધ્યમથી ખાનગી કંપનીઓની દવાઓ કરતાં વ્યાજબી ભાવે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેનેરીક દવાઓ મળી દ્વારા રોજગાર અને ઉદ્યોગસાહસિક - રહેશે. રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોએ સમગ્ર દેશના

કાર્યક્રમનો શુભારંભ મંડળ રેલ રેલવે સ્ટેશન ખાતે પ્રત્યક્ષ રૂપે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રનું વધારે જનઔષધિ કેન્દ્ર દ્વારા લાખો 🛮 ઉદ્દુઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે મેયર-અમદાવાદ શ્રીમતી વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, અમદાવાદ રેલવેના વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક શ્રી અન્નુ ત્યાગી સહિત રેલવે મંડળના અધિકારીઓ, કર્મચારીઓ નોન બ્રાન્ડેડ હોવાથી સસ્તી કિંમતે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

# CIDએ શરૂ કરી તપાસ, પ પોલીસકર્મીને નોટિસ

કિનારે લોકો સમોસા ખાતા જોવા મળશે. પરંતુ શું તમે વિચાર્યું છે કે સમોસા સમગ્ર પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ કરી શકે છે? કોંગ્રેસ શાસિત રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ કંઈક આવું જ બન્યું છે. આ દિવસોમાં હિમાચલની રાજનીતિમાં સમોસા પ્રચલિત છે. સમોસાના કારણે પાંચ પોલીસકર્મીઓને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. એટલું જ નહીં તેની સામે કડક શિસ્તભંગના પગલાંની ભલામણ કરવામાં આવી છે. રાજ્ય ઝૈંઢ તેની તપાસ કરી રહી છે. હકીકતમાં ૨૧ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ સાયબર વિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા ઝૈંઢ હેડક્વાર્ટર ગયા હતા. અહીં મુખ્યમંત્રી માટે લાવવામાં આવેલી કેક અને સમોસા તેમના સ્ટાફમાં વહેંચવામાં આવ્યા હતા.

## બેંગલુરુ ખાતે એનર્જા ટેક્નોલોજી મીટ ૨૦૨૪નું પેટ્રોલિયમ અને કુદરતી ગેસના માનનીય મંત્રીએ ઉદઘાટને કર્યું



સહયજમાન પદે, ઉર્જા ટેકનોલોજી થઈ છે. "ગ્રીન એનર્જી હોરાઇઝન્સઃ એન્ડ પેટોકેમિકલ્સ" થીમ હેઠળ

સ્થળ : મુંબઈ

તારીખ : ૧૨.૧૧.૨૦૨૪

ટેક્નોલોજી (CHT) દ્વારા આયોજિત તકનીકી નવીનતાને એકસાથે અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લાવવાના પ્લેટફોર્મ તરીકે સમર્થન લિમિટેડ (ઈન્ડિયન ઓઈલ) ના આપ્યું હતું. વૈશ્વિક ઉર્જા લેન્ડસ્કેપમાં ભારત દ્વારા ભજવવામાં આવેલી મીટ (ETM) ૨૦૨૪. બેંગલરુમાં શરૂ નિર્ણાયક ભમિકા અંગેનો ઉલ્લેખ કરતાં માનનીય મંત્રીએ જણાવ્યું હતું કે એડવાન્સિંગ સસ્ટેનેબલ રિફાઇનિંગ "આપણા રાષ્ટ્રની ઉર્જા માંગ ૨૦૪૭ સુધીમાં બમણી થવાની તૈયારીમાં છે, સંશોધકો, નીતિ નિર્માતાઓ અને અને આગામી બે દાયકામાં માંગમાં સંશોધકો ઉદ્યોગકારો એકછત્ર હેઠળ નોંધપાત્ર ૨૫% વધારો એકલા આવશે. તા. ૧૨ થી ૧૪ નવેમ્બર ભારતમાંથી અપેક્ષિત છે." શ્રી પુરીએ ૨૦૨૪ સુધીનો ત્રણ દિવસનો ઓઇલમાર્કેટિંગ કંપનીઓ (OMCs) અને કાર્યક્રમ, ટકાઉ ઉર્જા નવીનતાઓ ખાનગી ઉર્જા કંપનીઓની નેટ-શૂન્ય અને હરિયાળી ઉર્જા ઉકેલો તરફના લક્ષ્યાંકો હાંસલ કરવા માટેના સક્રિય સંક્રમણ પ્રત્યેની ભારતની અભિગમની પ્રશંસા કરી અને ઇથેનોલ, પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. હાઇડ્રોજન અને જૈવિક ઇંધણમાં પ્રગતિ ઈવેન્ટનું ઉદઘાટન કરતા પેટ્રોલિયમ દ્વારા વડાપ્રધાનના 'વિકસીત ભારત'ના અને કદરતી ગેસ બાબતોના માનનીય વિઝનને સમર્થન આપવા ભારતની મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ ETM- તૈયારીને સમર્થન આપ્યું હતું. (૨૨-૧)

### સુપરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ . રજિસ્ટર ઑફિસઃ પ્લોટ નં. 45, ફેઝ - II, પીપેરિયા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, સિલ્વાસા (D&NH),

ટેલિફોન: +91 22-22095630, વેબસાઇટ : www.supertex.in, ઇમેઇલ- info@supertex.in, CIN: L99999DN1986PLC000046, ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને અર્ધ વર્ષ માટે અનઓડીટેડ નાણાંકીય પરિણામોનું નિવેદન

	રૂા. લાખ							
		કવાર્ટર સમાપ્ત			અર્ઘ વ	વર્ષ સમાપ્ત		
ક્રમ નં.	વિગતો	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(ઓડિટેડ)	
		30.06.2028	30.05.2028	30.06.2023	30.06.2028	30.06.2023	39.03.2028	
1	કામગીરીમાંથી કુલ આવક (ચોખ્ખી)	1,242	2,930	2,682	4,173	3,766	9,082	
2	સમયગાળા માટે ચોખ્યો નફો (નુકશાન) (કર પહેલા અસામાન્ય અને / અથવા અસાધારણ વસ્તુઓ)	6	9	(6)	15	1	32	
3	કર પહેલાંના સમયગાળા માટે ચોખ્યો નફો (નુકશાન) (અસામાન્ય અને / અથવા અસાધારણ વસ્તુઓ પછી)	6	9	(6)	15	1	32	
4	કર પછીના સમયગાળા માટે ચોખ્યો નફો (નુકશાન) (અસામાન્ય અને / અથવા અસાધારણ વસ્તુઓ પછી)	56	(4)	(1)	52	(7)	11	
5	સમયગાળા માટે કુલ વ્યાપક આવક (કર પછી) અને અન્ય વ્યાપક આવક (કર પછી)			, ,		, ,		
	માટે નફો / (નુકશાનનો સમાવેશ)	54	(5)	(3)	49	(10)	17	
6	ઈકિવટી શેર કેપિટલ (મુળ કિંમત પ્રતિદીઠ રૂા. ૧૦/- ની)	1,134	1,134	1,134	1,134	1,134	1,134	
7	અનામત (પાછલા વર્ષની બેલેન્સ શીટમાં બતાવ્યા પ્રમાણે રિવેલ્યુએશન રીઝર્વને બાદ કરતાં)	3,056	3,002	2,979	3,056	2,979	3,007	
8	શેર દીઠ આવક (પ્રતિદિઠ રૂા. ૧૦ ની) (ચાલુ અને બંધ કામકાજો માટે) બેઝીક (રૂા.માં) ડાયલ્યુટેડ (રૂા.માં)	0.48 0.48	(0.04) (0.04)	(0.01) (0.01)	0.43 0.43	(0.08) (0.08)	0.15 0.15	

ઉપરોકત સેબી (લિસ્ટિંગ ઓબ્લિગિશન્સ એન્ડ ડિસ્કલોઝર રીકવાયરમેન્ટ્સ) રેગ્યુલેશન, ૨૦૧૫ ના નિયમન ૩૩ હેઠળ સ્ટોક એકસચેન્જ સાથે ફાઈનલ કરાયેલ તા. ૩૦.૦૯.૨૦૨૪ નો રોજ અનઓડીટેડ કવાર્ટર અને અર્ધ કવાર્ટર નાણાંકીય પરિણામોના વિગતવાર ફોર્મેટનો એક અર્ક છે. તા. ૩૦.૦૯.૨૦૨૪ ના રોજ પૂરા થયેલા કવાર્ટર અને અર્ધ કવાર્ટર અનઓડીટેડ નાણાંકીય પરીણામોનું સંપૂર્ણ ફોર્મેટ સ્ટોક ની વેબસાઈટ એટલે કે BSE લિમીટેડ ની વેબસાઈટ : www.bseindia.com અને કંપની ની વેબસાઈટ : www.supertex.in પર પણ ઉપલબ્ધ છે.

> સપરટેક્સ ઈન્ડસ્ટીઝ લિમીટેડ વતી. આર.કે. મિશ્રા, ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર

## દસ્તક ૨૦૨૪ થિયેટર અને ફિલ્મ ફેસ્ટિવલ માટે એવોર્ડ વિજેતા નિર્દેશકો અને દૂરદ્રષ્ટા કલાકારોને વડોદરા ખાતે લઈ આવે છે



અમદાવાદ. સિંગાપોર સ્થિત સામાજિક, પર્યાવરણીય અને થિયેટર કંપની WeCanDoIt, સિંગાપોરના પ્રખ્યાત હિન્દી થિયેટર, આર્ટ અને ફિલ્મ ફેસ્ટિવલ – 'દસ્તક'ના ભારત ખાતે પદાર્પણમાં જાણીતા દિગ્દર્શકોના એવોર્ડ વિજેતા નાટકો અને ફિલ્મોની વિશિષ્ટ રજૂઆત ગર્વથી રજૂ કરે છે. ગુજરાતમાં વડોદરાના એલેમ્બિક સિટી આર્ટ ડિસ્ટિક્ટ ખાતે ૨૨ થી ૨૪ નવેમ્બર સુધી યોજાનાર આ ત્રણ દિવસીય વાર્ડબ્રન્ટ ઇવેન્ટ સાંસ્કૃતિક વિચારોના શક્તિશાળી આદાનપ્રદાનને પ્રોત્સાહન આપશે,જેમાં ભારત અને સિંગાપોર ના કલાકારો દ્વારા થિયેટર પર્ફોર્મન્સ. પ્રભાવશાળી શોર્ટ ફિલ્મો અને હેન્ડ-ઓન વર્કશોપનું પ્રેરણાદાયી મિશ્રણ દર્શાવવામાં આવશે. દસ્તક ના ભારતમાં પદાર્પણ માટે, ઉીઝકહર્ટેં દ્વારા જાણીતી થિયેટર કંપની પેજ ટ્ર સ્ટેજ. અને એવોર્ડ વિજેતા ફિલ્મ પ્રોડક્શન હાઉસ ૩ પીપુલ પ્રોડક્શન્સ સાથે હાથ મિલાવ્યો છે.જેથી તાકીદની

નવપરિણીત મહિલા પર

તેનો જેઠ ખરાબ નજર

રાખતો હતો

જિલ્લામાં એક નવપરિણીત મહિલા

પર તેનો જેઠ ખરાબ નજર રાખતો

હતો. મહિલાને એકલી હોય ત્યારે

તકનો લાભ ઉઠાવતો હતો. જયારે

મહિલાએ આ અંગે પોતાના પતિને

કહ્યું તો તેણે જેઠને બદલેન

વપરિશીતાને ઘરની બહાર કાઢી

મૂકી. જયારે તેણીએ આનો વિરોધ કર્યો તો તેના સાસરિયાઓએ

પીડિતાને માર માર્યો. એટલું જ નહીં. પતિએ પીડિતાને ત્રણ વાર તલાક કહીને છટાછેડા પણ આપી દીધા.

પીડિતાના પિતાની ફરિયાદના

આધારે પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ

ભમૈડા ગામના રહેવાસી વ્યક્તિએ

કેસ નોંધાવ્યો છે. જેમાં જણાવવામાં

આવ્યું કે તેણે પોતાની પુત્રીના લગ્ન

૪ માર્ચ ૨૦૨૪ના રોજ મેરઠ

જિલ્લાના મુંડાલી પોલીસ સ્ટેશનના

ગામ મુંડાલીના રહેવાસી સલમાન

સાથે કર્યા હતા. પુત્રીના જેઠ

શાહિદની તેના પર ખરાબ નજર

હતી. પુત્રીએ જણાવ્યં કે. અવાર-

નવાર તક મેળવી જેઠ તેણીના રૂમમાં

આવીને છેડછાડ કરતો હતો. પુત્રીએ

આ અંગે તેમના સાસુ, નણંદ, પતિ

અને અન્ય પરિવારના સભ્યોને

જણાવ્યું ત્યારે તેઓએ પરિવારના

સન્માનને ટાંકીને કોઈને કહેવાનો

ઇનકાર કરી દીધો અને ગુનાને

પ્રોત્સાહન આપ્યું હતું. પીડિતાની

બહેન પણ મુંડાલીમાં રહે છે. જેણે

જણાવ્યું કે, તેની પુત્રીને તેના

સાસરિયાઓએ માર માર્યો હતો.

બાબુગઢ પોલીસ સ્ટેશનમાં

ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હાપુડ, ઉત્તર પ્રદેશના હાપુડ

સાંસ્કૃતિક થીમ્સનું અન્વેષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે , સહભાગીઓ અને પ્રેક્ષકો માટે વૈવિધ્યસભર. આકર્ષક અને પ્રભાવશાળી અનુભવનું વચન આપતા આ ફેસ્ટિવલમાં તેમની કુશળતા નો લાભ મળી રહે. વિસ્તરાયેલા એવોર્ડ વિજેતા દિર્ગદર્શકો અને ફિલ્મ નિર્માતાઓના જુથ ની ઉજવણી દસ્તક ૨૦૨૪ વખાણાયેલા ફિલ્મ નિર્માતાઓને હાઇલાઇટ કરે છે જેમના પ્રભાવશાળી વર્શનોને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. ફ્રેસ્ટિવલમાં સિંગાપોર સ્થિત પ્રતિભાશાળી ભારતીય કલાકાર. આદિત્ય મઝૂમદારની કૃતિઓ છે, જેઓ એક ચાલતી વાર્તા 'નીલંબરી' રજ કરશે. જેણે બેસ્ટ શોર્ટ ફિલ્મ અને બેસ્ટ કાસ્ટ એન્સેમ્બલ સહિત અનેક એવોર્ડ જીત્યા છે. ૩ પીપુલ પ્રોડક્શનની બીજી હૃદયસ્પર્શી ફિલ્મ.વિશ્વામિતિ વિલાસ. પણ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે. –

## વડોદરામાં પાણીની લાઈનોમાં ભંગાણની જાણકારી મેળવવા લગાવવામાં આવેલી "સ્કાડા સિસ્ટમ" નિષ્ફળ

માંજલપુર નવાપુરા માર્કેટ વિસ્તારમાં દિવાળીના તહેવારોમાં પાણીનો કકળાટ સર્જાયો હતો જે અંગે કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ રજૂઆતો કરી હતી. જયારે પાણીની લાઈનમાં ભંગાણ હોવા અંગેની જાણકારી મળતા કોંગ્રેસ કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે પાણીની લાઈનમાં પડતા ભંગાણ શોધી કાઢવા કોર્પોરેશનને કરોડો રૂપિયાના ખર્ચે સ્કાડા સિસ્ટમ લગાવી છે તે નિષ્ફળ નીવડી છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં નાખવામાં આવેલી વર્ષો મુખ્ય લાઈનમાં છેલ્લા કેટલાક સમારકામ આજે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ ભંગાણને કારણે લાખો લીટર પાણી કેટલીક જગ્યાએ વિશ્વામિત્રી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

નદીમાંથી પણ પસાર કરવામાં વડોદરા શહેરની મધ્યમાંથી આવી છે ત્યારે પાણીની મુખ્ય પસાર થતી વિશ્વામિત્રી નદીમાં લાઈનમાં છેલ્લા કેટલાક દિવસથી નાખવામાં આવેલી ફાજલપુરથી ભંગાણ પડ્યું હતું જેને કારણે લાખો આવતી પાણીની મુખ્ય લાઈનમાં લીટર પાણી વેડફાઈ રહ્યું હતું ત્યારે છેલ્લા એક મહિનાથી ભંગાણ કોર્પોરેશનના સત્તાવાળાઓના ધ્યાન હોવાથી શહેરના દાંડિયા બજાર પર આવતા કામગીરી શરૂ કરવામાં આવી છે.

પાણીની લાઈનમાં છેલ્લા એક મહિનાથી પડેલા ભંગાણ અંગે કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સૂર્વે એ આક્ષેપ કર્યો હતો કે, દિવાળીના તહેવારોમાં પીવાનું પાણી માત્ર ૧૫ થી ૨૦ મિનિટ મળતું હતું અને તે પણ ખૂબ જ ઓછા પ્રેશરથી મળતું હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરમાં કોઈપણ વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હોય તો તેની જાણકારી વહેલી તકે મળી રહે તે માટે સ્કાડા સિસ્ટમ લગાડવામાં આવી છે જૂની ફાજલપુરથી આવતી પાણીની તેમ છતાં વિશ્વામિત્રી નદીમાં જે રીતે છેલ્લા એક મહિનાથી પાણીની મુખ્ય દિવસોથી ભંગાણ પડ્યું હતું તેનું લાઈનમાં ભંગાણ પડ્યું હોય તેની જાણ કોર્પોરેશનને થઈ નહીં જેથી લોકો દિવાળીના તહેવારમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વડોદરા નદીમાં વહી જતું હતું. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી શહેરની પ્રજાને વાસદ મહીસાગર વિશ્વામિત્રી નદીમાં નાખવામાં નદીમાંથી પીવાનું પાણી પૂરું આવેલી વર્ષો જૂની ફાજલપુરથી પાડવામાં આવી રહ્યું છે ત્યારે આવતી પાણીની મુખ્ય લાઈનમાં ફાજલપુર ફ્રેન્ચવેલમાંથી વડોદરા છેલ્લા કેટલાક દિવસોથી ભંગાણ પડ્યું સુધી આવતી પાણીની મુખ્ય લાઈન હતું તેનું સમારકામ આજે કોર્પોરેશન

### SAR AUTO PRODUCTS LIMITED

Regd. Office: 50-E BHAKTINAGAR INDS ESTATE, RAJKOT 360 001

CIN: L34100GJ1987PLC010088 Website: www.sarautoproductsltd.com, Email: sapl@sarautoproductsltd.com

Extract of Unaudited Financial Result for the guarter ended on 30th September, 2024

	Extract of ordinated Financial Result for the quarter chaca on Soci September, 2024									
					(Rs.In La	cs except pe	er share data)			
Sr.			Quarter Ended		Half	Year	Year Ended			
No.	Particulars	30-Sep-24	30-Jun-24	30-Sep-23	30-Sep-24	30-Sep-23	31-Mar-24			
140.		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)			
1	Total Income from Operations (net)	434.66	379.70	520.09	814.36	898.08	2,003.58			
2	Net Profit/Loss for the period before Tax,	31.53	29.71	42.41	61.24	73.24	151.88			
2	Exceptional and Extra Ordinary Items	31.33	29./1	42.41	01.24	/3.24	131.00			
3	Net Profit/Loss for the period before Tax after	21.52	20.71	42.41	61.24	72.24	151.00			
3	Exceptional and Extra Ordinary Items	31.53	29.71	42.41	61.24	73.24	151.88			
4	Net Profit/Loss for the period after tax (after	31.53	29.71	42.41	61.24	73.24	116.70			
4	Extraordinary Items)	31.33	29./1	42.41	61.24	/3.24	116.70			
5	Total comprehensive income for the period	31.60	29.98	43.10	61.58	73.22	114.18			
6	Paid up Equity Share Capital	476.47	476.47	476.47	476.47	476.47	476.47			
	(Face Value of Share Rs. 10 each )									
7	Reserves Excluding Revaluation Reserves	-	-	-	-	-	1,212.11			
8	Earnings per Share (EPS) (for continuing operations)									
	( a ) Basic (Not Annualized)	0.66	0.62	0.89	1.29	1.54	2.45			
	( h ) Diluted (Not Annualized)	0.66	0.62	0.89	1 29	1 54	2 45			

a) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity

) The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s accounting policies shall be disclosed by means of a footnote.

c) # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.

> For and on behalf of Board of Director, Ramesh D. Virani **Managing Director** DIN: 00313236

Place: Rajkot Date: November 13, 2024

**બ્રાન્ય ઓફિસ**ઃ આઈસીઆઈસીઆઈ બેંક લી., ઓફ્સિ નંબર ૨૦૧-બી, ૨જો માળ, રોડ નં.૧ પ્લો **િ ICICI Bank** નં.- બી૩, વાઇફાઈ આઈટી પાર્ક, વાગલે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, થાશે (પશ્ચિમ), મહારાષ્ટ્ર- ૪૦૦૬૦૪

બાથી સિક્યરાઇઝેશન રિકેસ્ટક્શન કાઇનાન્સ એસેટ એન્ડ ઇનકોર્મ્સમેન્ટ ઓફ સિક્યરિટી ઓફ ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અને સિક્યરિટી ઇન્ટરેસ્ટ ઇન્ફોર્સમેન્ટ ૨૦૦૨ની કલમ ૧૩ (૧૨) તેની સાથે અનુચ્છેદ ૩ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ અહી નીચે સહી કરનાર આઈસીઆઈસીઆઈ બેંકના સત્તાવાર અધિકારીએ નીચે જણાવેલ લોકોને માંગણા નોટીસ આપી છે. આ નોટીસ આપ્યાથી ૬૦ દિવસની અંદર અહીં દર્શાવેલા નાણા ભરી જવા જણાવવામાં આવે છે. રજદારો નાણા ચૂકવવામાં નિષ્કળ ગયા છે. આથી કરજદારો અને સામાન્ય જનતાની જાણ માટે નીચે જણાવેલા અધિકારીએ અહી જણાવેલી

મિલ્કતનો કબ્જો લીધો છે જે કલમ ૧૩ (૪) અનુચ્છેદ ૮ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ કાર્યવાહી કરી છે. કરજદારો અને સામાન્ય જનતાને ખાથી ચેતવણી આપવામાં આવે છે કે આઈસીઆઈસીઆઈ બેંક લીમીટેડ પાસે આ મિલ્કત ટાંચમાં હોય કરજદારો અને સામાન્ય જનતાએ કોઈ પણ

પ્રકારનો વ્યવહાર કરવો નહીં.									
ક્રમ નં.	લોન એકાઉન્ટ નંબર	મિલ્કતની વિગત / પ્રતિકાત્મક કબ્જાની તારીખ	ડિમાંડ નોટીસની તારીખ / ડિમાંડ નોટીસની રકમ (રૂ)	શાખાનું નામ					
٩.	પૂનમદેવી અખિલેશ સિંઘ/ અખિલેશ કલ્પનાથ સિંઘ- LBABD00004975635	ફલેટ નં.૨૦૨, બ્લોક નં. એચ, બીજો માળ, મારૂતી સૃષ્ટિ, શનિદેવ મંદિરની પાછળ, જી વોર્ડ કુબેરનગર મોજે-સરદાર નગરી, સીએસ નં. ૨૨૪૫, અમદાવાદ-ગુજરાત, અમદાવાદ-૩૮૦૦૨૫ -૦૯ નવેમ્બર, ૨૦૨૪	સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૧ રૂા. ૧૭,૩૪,૫૨૫.૯૮/-	અમદાવાદ					
૨.	સહજાની દિનેશ રૂપચંદ/ સહજાની સુનિતાબેન- LBABD00005665689	કલેટ નં.૨૦૩, બીજો માળ, બ્લોક ઈ, ઓઝોન સીટી, આઈટીઆઈ રોડ, આ૨.એસ.નં. ૨૮૨/૧+૨+૨૮૮+૨૮૯+૨૯૯/૧+૨, ટી.પી. એસ.નં. ૯૭, એક.પી.નં. ૭, સબ-પ્લોટનં. ૧, કુબેરનગર, નરોડા, અમદાવાદ- ૩૮૦૦૦૯-૦૯ નવેમ્બર, ૨૦૨૪	જૂન ૦૨, ૨૦૨૩ રૂા. ૨૪,૫૭,૩૮૦.∞/-	અમદાવાદ					
з.	મન્તાનાથ/સુમન- LBBRD00004970127	ઓફિસ નં.૨૨૪, બીજો માળ, લાભ આઈકન, બંસલ મોલની પાસે, ૩૦ મી. ગોત્રી વાસણા રોડ, આર.એસ.નં. ૯૦૭/, સી.એસ.નં. ૧૭૮૪, ટી.પી.એસ નં. ૬૩, એફ.પી.નં. ૧૦૩ (નં. ૧૦૩નો ઉત્તરનો ભાગ), વાસણા ભાયલી રોડ, ગોત્રી, ગોરવા, વડોદરા-૩૯૦૦૧૬ - ૦૯ નવેમ્બર, ૨૦૨૪	િક્સેમ્બર ૩૦, ૨૦૨૩ રૂા. ૧૮,૩૨,૯૬૧.∞/-	વડોદરા અને બિકાનેર					
8.	કિશોરભાઈ રાવજીભાઈ રાઠોડ/ચંપાબેન કિશોરભાઈ રાઠોડ- LBBRD00005733347	ફલેટ નં.બી-૩૦૧, ત્રીજો માળ, ટાવર-બી, શ્રી સિદ્ધેશ્વર હરિ દર્શન, સપ્તપદી પાર્ટી પ્લોટની પાછળ, બ્લોક/આર.એસ.નં. ૪૯૮/૧/૧, ટી.પી.એસ.નં. ૪૮, એફ.પી.નં. ૬૪/૧, ગુરૂદ્ધારાની સામે, આલ્સ્ટોમ ગોડાઉનની પાસે, છાણી રોડ, છાણી, વડોદરા-૩૯૧૭૩૦ - ૦૯ નવેમ્બર, ૨૦૨૪	ફેબ્રુઆરી ૨૯, ૨૦૨૪ રૂા. ૧૯,૭૫,૬૦૯.૦૦/-	વડોદરા					
ય.	મોરે મયૂર નાનાભાઈ/ મોરે નાનાભાઈ રાજારામ/ મોરે સંગીતાબેન નાનાભાઈ/ મોરે કિશોરકુમાર- LBBRD00005835138	બ્લોક નં.ઈ-૬૩, સુરભી પાર્ક હાઉસિંગ સોસાયટી, સમતા પોલિસ સ્ટેશન પાસે, આર.એસ. નં. ૫૦૪, ૫૦૭, સુભાનપુરા, ગોત્રી, વડોદરા-૩૯૦૦૨૩ - ૦૯ નવેમ્બર, ૨૦૨૪	ફેબ્રુઆરી ૧૨, ૨૦૨૪ રૂા. ૨૦,૪૬,૩૬૩.૦૦/-	વડોદરા					
€.	ભોરણિયા ફાતમા/ભોરણિયા અલિઅકબર - LBMBl00005269375	સબ પ્લોટ નં. ૩૯-૫૦/૧૬, (સી-૬૬), વિશી નગર ટાઉનશીપ, એસ.નં. ૧૫૫/૧ પૈકી ૨, પ્લોટ નં. ૧ થી ૪૦, અમરેલી રોડ પાસે, વિશીપુરા, વિશી ફાટક પાસે, રાજકોટ-૩૬૦૦૦૧ -૦૯ નવેમ્બર, ૨૦૨૪	એપ્રિલ ૨૬, ૨૦૨૩ રૂા. ૭,૩૩,૮૬૧.૦૦/-	રાજકોટ					
9.	આનંદભાઈ એન. મકવાણા/ પદમાબેન એ. મકવાણા - LBMBl00005121715	પ્લોટ નં. ૩૫ પૈકી ઉત્તર વિભાગ, રણછોડ નગર, મદીના સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન પાછળ, નવલખા રોડ, આર. એસ.નં. ૧૪૯પી, અમરેલી, મોરબી-૩૬૩૬૪૧ -૦૯ નવેમ્બર, ૨૦૨૪	સપ્ટેમ્બર ૦૧, ૨૦૨૩ રૂા. ૧૭,૯૯,૮૫૬.∞/-	અમરેલી- મોરબી					
۷.	અંબાલાલ રાણારામ દરજી/ રેશમીદેવી અંબાલાલ દરજી - LBABD00002369678	ફ્લેટ નં. એ ૨૦૩, બીજો માળ, બ્લોક નં. એ, સત્વ ૨, એસ નં. ૫૭૯, ટી.પી.એસ. નં. ૫૮, એફ.પી. નં. ૫૮/૨, તા. અને મોજે - વટવા, અમદાવાદ-૩૮૦૦૦૧ - ૧૦ નવેમ્બર, ૨૦૨૪	જૂન ૨૨, ૨૦૧૭ રૂા. + ૧૪,૬૭,૨૫૭.∞/-	અમદાવાદ					
હ.	સ્વામીશરન રામાપતિ/ બાબુલી રામાપતિ - LBBRD00005365625	ઘર નં. ૧૫/૩, ગ્રાઉન્ડ ફ્લોર, મ્યુનિસીપલ કોર્પોરેશન પ્રોપર્ટી નં. ૭૩૧૬/૨, અર્પણ સોસાયટી, કાંજરી રોડ, ઝવેરનગર સોસાયટી પાસે, આર.એસ નં. ૧૮૫- પૈકી-૫૯, ખાતા નં. ૫૨૬, મંગલમૂર્તિ રોડ, વિઠાપુરા, હાલોલ, પંચમહાલ- ૩૮૯૩૫૦ - ૧૦ નવેમ્બર, ૨૦૨૪	િસ્મેમ્બર ૨૬, ૨૦૨૩ રૂા. ૧૫,૫૧,૭૭૮.૦૦/-	પંચમહાલ હાલોલ અને રેવા					
90.	·અનિલ કિશનચંદ્ર ધામનાની/ ધામનાની હેમાબેન કે - LBBRD00006151970 LBBRD00006151981	ફલેટ નં. સી-પ, પહેલો માળ, ટાવર-સી, શિવ ધારા ફલેટ્સ, પટેલ પાર્ક પાછળ, આર.એસ નં. ૮૨૨/૧, વોર્ડ નં. ૧૬૮/૯૮-૯૯, સી.ટી.એસ. નં. ૧૬૨/૧/બી, વરસિયા રોડ, વડોદરા-૩૯૦૦૦૬ - ૧૧ નવેમ્બર, ૨૦૨૪	ફેબ્રુઆરી ૧૪, ૨૦૨૪ રૂા. ૧૧,૪૬,૬૧૬.૦૦/−	વડોદરા					
 ઉપર	જણાવેલા કરજદાર(રો)/જામીન્	ા દાર(રો)અહીબાકી નાણાં પરત કરી જવા માટે ૩૦દિવસની નોટીસ આપવામાં આવેઃ	 છે. નહીંતો કલમ ૮ અન્	' ને ૯ સિક્યુરિટી					

ઇન્ટરેસ્ટ (ઇન્ફોર્સમેન્ટ) રૂલ, ૨૦૦૨ની જોગવાઈ મુજબ જામીન તરીકે મુકેલી મિલ્કત આ નોટીસ પ્રસિદ્ધ થયાનાં ૩૦ દિવસ બાદ વેચી દેવામાં આવશે.

તારીખ: ૧૪-૧૧- ૨૦૨૪ નિષ્ઠાવાન અધિકૃત અધિકારી સ્થળ ઃ ગુજરાત આઈસીઆઈસીઓઈ બેંક લીમીટેડ